

HIR PARK

SARVEY NO.94/2, T.P.S.NO.12 (TARSAMIYA), O.P.NO.11, F.P.NO.11, PURV ZONAL
OFFICE SAME, TARSAMIYA ROAD, BHAVNAGAR

ઓનરશીપ બેઈઝથી પ્લોટનો વેચાણ દસ્તાવેજ

ગુજરાત રાજ્યના ડિસ્ટ્રીક્ટ: ભાવનગર તાલુકાના મોજે તરસમીયા ગામની સીમના રેવન્યુ સર્વે નં.૯૪/૨ની નગર રચના યોજના નં.૧૨ (તરસમીયા) ના મૂળ ખંડ નં.૧૧, અંતિમ ખંડ નં.૧૧, ટી.પી.સ્કીમ નં.૧૨ તરસમીયા(ફાઈનલ)ની જમીન ઉપર રેહણાંક હેતુ માટે કરવામાં આવેલ બિનખેતી કરવામાં આવેલ પ્લોટો ૧ થી ૧૨, ૧૨-એ, ૧૪ થી ૨૩, ૨૪-૨૫, ૨૬, ૨૭-૨૮ અને ૩૩ થી ૪૦ નું કુલ ક્ષેત્રફળ ૪૦૫૩.૦૦ ચો.મી. થાય છે. જે નોંધાયેલ પ્લોટ નં ૧ થી ૧૨, ૧૨-એ, ૧૪ થી ૨૩, ૨૪-૨૫, ૨૬, ૨૭-૨૮ અને ૩૩ થી ૪૦ ની જમીન ઉપર ભાવનગર મહાનગરપાલિકામાં મંજૂર થયેલ પ્લાન મુજબથી પ્રોજેક્ટ “હીર પાર્ક” ના નામથી ઓળખાય છે. પ્લોટ નંબર. **એરીયા** ચો મી. (જેના કોમન પ્લોટ ના વરાડે આવતી જમીનની બિનખેતી લિઝ તથા આકાર ભરવાની શરતને આધીન કોમન પ્લોટના વરાડની જમીન ----- ચો.મી જેનો વેચાણમા સમાવેશ નથી)

તે ખુલી જમીનનો વેચાણ દસ્તાવેજ.

વેચાણ કિંમત સ્ટેમ્પ ડ્યુટી.....

આ વેચાણનો દસ્તાવેજ શહેર ભાવનગર મધ્યે આજ તારીખના રોજ.

લખી આપનાર :

" ઠાકરશીભાઈ નરશીભાઈ જાસોલિયા તથા અન્ય"

- ૧) ઠાકરશીભાઈ નરશીભાઈ જાસોલિયા
- ૨) પ્રેમજીભાઈ પાર્સોત્તમભાઈ પટેલ
- ૩) શંભુભાઈ નરશીભાઈ જાસોલિયા
- ૪) રામજીભાઈ પાર્સોત્તમભાઈ પટેલ
- ૫) પ્રકાશભાઈ દેવરાજભાઈ જાસોલિયા
- ૬) રાકેશભાઈ પ્રવિણભાઈ જાસોલિયા
- ૭) મધુબેન પ્રવિણભાઈ જાસોલિયા
- ૮) અક્ષય પ્રવિણભાઈ પટેલ

સરનામું: “હીર પાર્ક”, પ્લોટ નં.૧ થી ૨૮ અને ૩૩ થી ૪૦ રેવેન્યુ સર્વે નં.૯૪/૨,ટી.પી.એસ. નં.૧૨(તરસમીયા) ઓ.પી.નં.૧૧, એફ.પી.નં.૧૧, પુર્વ ઝોનલ ઓફિસ સામે તરસમીયા રોડ, ભાવનગર.

લખાવી લેનાર :

(૧) નામ -

ઉ.વ.આ....., ધર્મે :, ધંધો :

રહે.ઠે.....

તે લખાવી લેનાર/પ્લોટ ખરીદનાર

(આધાર કાર્ડ નં.....)

(હવે પછી અહીં જેમનો ઉલ્લેખ બીજા પક્ષકાર "....." તરીકે કરવામાં આવ્યો છે.)

તે શબ્દ પ્રયોગમાં જો તે સંદર્ભ અથવા અર્થથી વિરુદ્ધ ન હોય તો તે શબ્દોમાં ઉત્તરાધિકારી, વહીવટકર્તા, પ્રબંધક, પરવાનગી આપેલ એસાઈની તથા સંબંધીત ભાગીદારો સહિત તમામનો સમાવેશ થશે.

(૧) ×××××××× (PAN : _____)

ઉ.વ.આ....., ધર્મે :, ધંધો :

રહે.ઠે.....

તે લખી આપનાર/પ્લોટ વેચનાર

(આધાર કાર્ડ નં.....)

(હવે પછી અહીં જેમનો ઉલ્લેખ બીજા પક્ષકાર "....." તરીકે કરવામાં આવ્યો છે.)

તે શબ્દ પ્રયોગમાં જો તે સંદર્ભ અથવા અર્થથી વિરુદ્ધ ન હોય તો તે શબ્દોમાં ઉત્તરાધિકારી, વહીવટકર્તા, પ્રબંધક, પરવાનગી આપેલ એસાઈની તથા સંબંધીત ભાગીદારો સહિત તમામનો સમાવેશ થશે.

જત તમો પ્લોટ ખરીદનાર/એલોટી જોગ અમો પ્લોટ વેચાણ આપનાર/પ્રમોટર આ પ્લોટનો વેચાણ દસ્તાવેજ નીચેની વિગતે અને શરતોએ કરી આપીએ છીએ.

- (૧) ગુજરાત રાજ્યના ડિસ્ટ્રીક્ટ: ભાવનગર તાલુકાના મોજે તરસમીયા ગામની સીમના રેવન્યુ સર્વે નં.૯૪/૨ની નગર રચના યોજના નં.૧૨ (તરસમીયા) ના મૂળ ખંડ નં.૧૧, અંતિમ ખંડ નં.૧૧, ટી.પી.સ્કીમ નં.૧૨ તરસમીયા(ફાઈનલ)ની જમીન ઉપર રેહણાંક હેતુ માટે કરવામાં આવેલ બિનખેતી કરવામાં આવેલ પ્લોટો ૧ થી ૧૨, ૧૨-એ, ૧૪ થી ૨૩, ૨૪-૨૫, ૨૬, ૨૭-૨૮ અને ૩૩ થી ૪૦ નું કુલ ક્ષેત્રફળ ૪૦૫૩.૦૦ ચો.મી. થાય છે. જે નોંધાયેલ પ્લોટ નં ૧ થી ૧૨, ૧૨-એ, ૧૪ થી ૨૩, ૨૪-૨૫, ૨૬, ૨૭-૨૮ અને ૩૩ થી ૪૦ ની જમીન ઉપર ભાવનગર મહાનગરપાલિકામાં મંજૂર થયેલ પ્લાન મુજબથી પ્રોજેક્ટ “હીર પાર્ક” ના નામથી ઓળખાય છે.
- (૨) ત્યાર બાદ ઉપરોક્ત રીતે અમો ભાવનગર તાલુકાના મોજે તરસમીયા ગામની સીમના રેવન્યુ સર્વે નં.૯૪/૨ની નગર રચના યોજના નં.૧૨ (તરસમીયા) ના મૂળ ખંડ નં.૧૧, અંતિમ ખંડ નં.૧૧, ટી.પી.સ્કીમ નં.૧૨ તરસમીયા(ફાઈનલ)ની જમીન ઉપર રેહણાંક હેતુ માટે કરવામાં આવેલ બિનખેતી કરવામાં આવેલ પ્લોટો ૧ થી ૧૨, ૧૨-એ, ૧૪ થી ૨૩, ૨૪-૨૫, ૨૬, ૨૭-૨૮ અને ૩૩ થી ૪૦ નું કુલ ક્ષેત્રફળ ૪૦૫૩.૦૦ ચો.મી. થાય છે. જે નોંધાયેલ પ્લોટ નં ૧ થી ૧૨, ૧૨-એ, ૧૪ થી ૨૩, ૨૪-૨૫, ૨૬, ૨૭-૨૮ અને ૩૩ થી ૪૦ ની જમીન ઉપર ભાવનગર મહાનગરપાલિકામાં મંજૂર થયેલ પ્લાન મુજબથી પ્રોજેક્ટ “હીર પાર્ક” ના નામથી ઓળખાય છે.
- (૩) ઉપરોક્ત મિલકત અંગેના રોજ અમોની “ઠાકરશીભાઈ નરશીભાઈ જાસોલિયા તથા અન્ય” ના અધિકૃતને સંયુક્ત પણે અથવા વિભક્ત પણે તેમની હાજરી અને સહીથી તેમના વતી તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી તથા વહીવટ કરવા પ્લોટ નો તમામ પ્રકારનો વહીવટ અને વ્યવહાર કરવાની સત્તા અને અધિકાર ધરાવીએ છીએ.
- (૪) ઉપરોક્ત વિગતે કરેલ પ્લોટ માટેની નામકરણ “હીર પાર્ક” કરેલ છે. સદરહુ “હીર પાર્ક” ના નામથી ઓળખાતા પ્લોટ જેની વિગત તથા ચતુર્સિમા આ સાથેની નીચે પરિશિષ્ટ-૧ માં આપવામાં આવેલ છે. તે માંહેથી ઉપર આવેલ પ્લોટ નં..... એરીયા ચો.મી..... છે. સદરહુ પ્લોટની વિગત તથા ચતુર્સિમા આ સાથે નીચે પરિશિષ્ટ-૨ માં આપવામાં આવેલ છે. સદરહુ પ્લોટ તમો લખાવી લેનારને કુલ વેચાણ કિંમત રૂા..... અંકે રૂપિયા પુરામાં વેચાણ આપવામાં આવે છે. સદરહુ પ્લોટને સંલગ્ન આપવામાં આવેલ છે. સદરહુ પ્લોટ તમો ખરીદનારને ઉપરની કિંમતે વેચાણ આપવામાં આવેલ છે. તેની અવેજની રકમ અમોને નીચેની વિગતે મળેલ છે.

- (૫) સદરહુ પ્લોટના અવેજની રકમ નીચેની વિગતે તમો લખાવી લેનાર તરફથી અમો લખી આપનારને મળી ગયેલ છે. જેની આથી અમો પહોંચ સ્વીકારીએ છીએ.

રૂા. અંકે રૂપિયા
રૂા. અંકે રૂપિયા
રૂા. અંકે કુલ રૂપિયાપુરા.

- (૬) સદરહુ વેચાણ આપવામાં આવતો પ્લોટ અમારા કબજા ભોગવટા તથા માલીકી હકકનો આવેલ છે. તેમાં અમારા સિવાય બીજા કોઈનો કોઈપણ પ્રકારનો હકક, હિસ્સો, હિત-ભાગ, દર-દાવો, લાગ-ભાગ નથી કે સદરહુ પ્લોટ ઉપર કોઈનો વારસાઈ હકક નથી કે તેના ઉપર કોઈપણ બેંકમાંથી લોન લેવામાં આવેલ નથી કે કોઈની જામીનમાં નથી કે તેવી કોઈ જામીનગીરી સ્વીકારેલ નથી. તેવી સ્પષ્ટ ખાતરી આપીને તમોને વેચાણ આપવામાં આવે છે.

- (૭) સદરહુ વેચાણ આપવામાં આવતા પ્લોટ અંગેનો અવેજ સંપૂર્ણ રીતે અમોને ઉપરની વિગતે મળી ગયેલ છે. તેથી તેનો કબજો આજરોજ તમોને સોંપી આપવામાં આવેલ છે. તે તમો તથા તમારા વંશ-વાલી વારસો યાવતચંદ દિવાકરો સુખેથી રહેજો વસજો યા વસાવજો તેના સામે હવે પછી અમારો કે અમારા વંશ, વાલી, વારસોનો કે કોઈપણનો કોઈપણ પ્રકારનો વાંધો ઉઠાવવાના હકક નથી. તેવી સ્પષ્ટ ખાતરી આપીને તમો વેચાણ આપવામાં આવે છે.

- (૮) સદરહુ વેચાણ આપવામાં આવતા પ્લોટ અંગેના જે જે કોઈ ટેક્ષ જેવા કે વેરાબીલો, કોર્પોરેશન હાઉસ ટેક્ષ વિગેરે જે જે ભરવાના થાય તે અમોએ કમ્પ્લીશન તારીખ સુધીના તમામ ભરી આપેલ છે. હવે પછી આ પ્લોટ તમો તમારા નામે જે જે ખાતામાં ટ્રાન્સફર કરાવવાનો થાય ત્યાં ત્યાં અમારે સહી કરી આપીને આ પ્લોટ તમારા ખર્ચે ટ્રાન્સફર કરાવી લેવાનો છે. તેમજ તેમ ન થતા તેની લાગતી વળગતી તમામ પ્રકારની જવાબદારી આ દસ્તાવેજ થયેથી તમોની રહેશે. તેમજ તે ન થતા અમો તે પ્રકારના તમામ કનેક્શનો રદ કરવાની અરજીઓ આપી રદ કરાવી નાંખીશું તેમજ આ પ્લોટ અંગેના કમ્પ્લીશન તારીખ સુધીના કોઈ વેરા બીલ ભરવાના બાકી નીકળે તે ભરી આપવાની જવાબદારી અમારા ઉપર છે.

- (૯) સદરહુ તમોને વેચાણ આપવામાં આવતા પ્લોટ અંગેના અમારા તથા અમારા પુરોગામીના ટાઈટલ ડીડની ફક્ત ઝેરોક્ષ ફાઈલ તમોને સોંપી આપેલ છે. જે તમોએ ચેક કરેલ છે.

- (૧૦) સદરહુ વેચાણ આપવામાં આવતો પ્લોટ આવેલ હોયને જેમાં નીચે દર્શાવેલ ખાસ નિયમો તથા શરતોનું તમારે પાલન કરવાનું રહેશે. જે શરતે જ તમો જોગ વેચાણ દસ્તાવેજ કરી

આપવામાં આવે છે. જે પાલન નહીં થયે દસ્તાવેજ રદ્દ કરવામાં આવશે. જેની આથી સ્પષ્ટતા કરવામાં આવે છે.

૧) વેચાણ દસ્તાવેજ કર્યા બાદ પ્લોટમાં આવેલ કોઈપણ વસ્તુ પર અમો કોઈ હકક તેમજ કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં.

૨) સદરહુ તમોને આજરોજ વેચાણ આપેલ પ્લોટ સંબંધે કોઈપણ પ્રકારના સરકારી કે અર્ધ સરકારી ટેક્સ ભરવાનો થાય તે અમારે ભરપાઈ કરી આપવાનો છે. જે તમામ ખર્ચ ચાર્જ ભવિષ્યમાં થાય તે હવે પછી તમારે ભરપાઈ કરવાના છે. તેમજ સદરહુ પ્લોટ, સરકારી, અર્ધ-સરકારી કચેરીઓમાં તમામ જગ્યાએ દસ્તાવેજ થયાની તારીખથી દિવસ-૧૫ માં તમો તમારા નામે ટ્રાન્સફર કરાવી લેવાનું રહેશે અને તે માટે જરૂર પડયે અમારે સહીઓ કરી આપવાની રહેશે તેમજ હાજર રહી તે અંગેની સંમતિ આપવાની છે. તેમજ આ તમોને વેચાણ આપેલ પ્લોટ સંબંધે કે દસ્તાવે જ સંબંધે જો કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી ટેક્સ (કેન્દ્ર કે રાજ્ય સરકારના અન્ય ટેક્સો) ભરવાનો થાય એટલે કે કોઈપણ જાતના સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ કે જી.એસ.ટી. ટેક્સ વિગેરે વધ-ઘટ કે ઉમેરો થતા જે કંઈ ખર્ચ થાય તે તમોએ એટલે કે ખરીદનારે ભરપાઈ કરી આપવાનો રહેશે.

૩) સદરહુ પ્લોટ વાળી મિલકતના ટાઈટલ ડીડ ટાઈટલ કલીયર અને માર્કેટબલ છે અને જે તમોએ જોઈ તપાસીને ખરાઈ કરી અને કરાવી કબુલ કરેલ છે, અને કલીયર અને માર્કેટબલ હોવા અંગેની ખાતરી કરેલ છે. જે હકીકતે સદરહુ પ્લોટના કલીયર અને માર્કેટબલ ટાઈટલ અંગે તમો લખાવી લેનારને વાંધો તકરાર નથી તેમજ તમામ ઉતરોતરના લેખ-દસ્તાવેજોની ઝેરોક્ષ નકલો તમો ખરીદનારને સોંપી આપેલ છે. ભવિષ્યમાં જરૂર પડયે ખરી નકલો (સર્ટીફાઈડ નકલો) તમારે તમારા ખર્ચે કઢાવવાની રહેશે. જેની આથી સ્પષ્ટતા કરવામાં આવે છે.

૪) સદરહુ પ્લોટના વેચનારના તમામ પ્રકારના હકકો જેવા કે માલીકી કબજાઓ સહીત ખરીદનારને આ પ્લોટ વેચાણ આપેલ છે. ખરીદેલ પ્લોટ નો કબજો વિના તકરારે સંભાળી લીધેલ છે.

૫) સદરહુ “હીર પાર્ક” માં તમોએ વેચાણ રાખેલ પ્લોટ અંગેના જે કાંઈ વેરાઓ ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન કે સરકારને ભરવાના થાય તો તે વેચાણ દસ્તાવેજની તારીખથી તમો ખરીદનારે અંગત રીતે જ ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન તેમજ સરકારશ્રીને આપવાના રહેશે. તેમજ આ તમામ જાતના ટેક્સ કોર્પોરેશન તથા સરકારશ્રી તરફથી વધારવામાં આવે તો તે ટેક્સો તમો ખરીદનારે ભરવાના રહેશે.

- ૬) સદરહુ જમીનનું નામ અમોએ “હીર પાર્ક” રાખેલ છે. તે નામમાં તમો ક્યારેય કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકશો નહીં કે બદલી કશકશો નહીં.
- ૭) આ અપણા બન્ને. પક્ષકારો વચ્ચે થયેલ ડોક્યુમેન્ટસને લગતા કોઈપણ પ્રકારના કોર્ટ પ્રોસીડીંગ્સ માટેનું જયુરીસડીકશન ભાવનગર શહેરે રહેશે. જેની જાણ તમો પ્લોટ હોલ્ડરને કરવામાં આવે છે. હાલ સદરહુ જમીનમાં ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ છે. ભવિષ્યમાં ફાઈનલ ટી.પી. સ્કીમ આવ્યે તેમાં જે કંઈ સુધારા વધારા, ફેરફાર આવે તે તમો ખરીદનારને બંધનકર્તા રહેશે.
- ૮) સદરહુ પ્લોટ નો પાકો વેચાણ દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવવામાં થતો ખર્ચ જેવો કે સ્ટેમ્પ પેપર, રજિસ્ટ્રેશન ફી, વકીલ ફી વિગેરે તમામ ખર્ચ લખાવી લેનારના શીરે છે. એટલે કે ખરીદનારને શીરે છે.
- (૧૧) સદરહુ પ્લોટ આવેલ હોઈને તેના નીતિ-નિયમોનું પાલન કરવાની જવાબદારી તમો લખાવી લેનારની રહેશે અને આ પ્લોટ અંગે કલમ-૧૭ હેઠળ લખાયેલ શરતો મુજબ તમોએ આ પ્લોટનો ઉપયોગ તેના નીતિ-નિયમો મુજબ કરવાનો રહેશે.
- (૧૨) સદરહુ પ્લોટિંગમાં આવેલ પ્લોટ અંગેની અમોએ પ્રમોટરે રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન અને ડેવલપમેન્ટ) એક્ટ-૨૦૧૬ ની જોગવાઈ હેઠળ સત્તાધિકારી પાસે રજિ. નં..... તા..... થી નોંધણી કરાવેલ છે અને તે અંગેનું સાટાખત અમોએ "રેરા" કાયદાની કલમ-૧૪ મુજબ અનુક્રમ નં..... તા..... થી નોંધાવેલ છે. જેથી આપણે બન્ને પક્ષકારોએ ઉપરોક્ત વર્ણવેલ 'રેરા' ના કાયદાની જુદી જુદી કલમોનું પાલન કરવાનું રહેશે. જેની આથી સ્પષ્ટતા કરવામાં આવે છે.
- (૧૩) ભવિષ્યમાં જો કોઈ પણ ડિસપ્યુટ ઉભો થાય તો તેનું નિરાકરણ બન્ને પક્ષ કારો ધ રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ-૨૦૧૬ ના કાયદાના જોગવાય હેઠળ કરવામાં આવશે.
- (૧૪) અલોટી તથા અન્ય બીજા અલોટી જે પ્લોટિંગ / બિલ્ડિંગ સ્કીમમાં જોડાય છે તેઓએ પ્રમોટરને સહયોગ તથા સહકાર આપી સોસાયટી અથવા એસોસિએશનને રજીસ્ટર કરવામાં સભ્ય થવાનું રહેશે અને આ કાર્ય માટે ટાઈમ ટુ ટાઈમ સહી અને સોસાયટી રજીસ્ટ્રેશન માટેના ડોક્યુમેન્ટ તથા વિગતો પ્રમોટરને સાત દિવસની અંદર આપવા જ્યારથી પ્રમોટર સોસાયટી બનાવવાની રજુવાત કરે છે પ્રમોટરને સોસાયટી અથવા એસોસિએશનનું નામ નક્કી કરવાના તમામ અધિકાર છે.કોઈ પણ પ્રકારનું ચેન્જ તથા

મોડીફિકેશન ડ્રાફ્ટ બાઇ-લો, મેમોરેડમ / આર્ટીકલ ઓફ એસોસીએશન જરૂરિયાત પ્રમાણે જનાશે તેનો પ્રમોટરને તમામ હકક છે.

(૧૫) કોમન એરિયાનું સંચાલન પ્રમોટર તથા એલોટેડ એલોટી દ્વારા પ્રમુખ અને તેની કમીટી તે કોમન એરિયા અને સોસાયટીને લગતા તમામ એડમિનિસ્ટ્રેટિવ કાર્ય જાળવણી(ટેમરેખ) કરશે.

(૧૬) કલોજ લિંકિંગ AFS રજીસ્ટ્રેશન તથા AFS રજીસ્ટ્રેશન તારીખ

(૧૭) SEVERABILITY : અલગતા બાબત

આ કરાર હેઠળની કોઈ જોગવાઈ આ કાયદા અથવા તે હેઠળ નિયમો અથવા નિયમન અથવા કોઈપણ લાગુ પડતા કાયદા હેઠળ રદપાત્ર હોય અથવા લાગુ પડી શકે તેમ જ હોય તો કરારની તે જોગવાઈઓ આ કરારના હેતુ માટે વ્યાજબી રીતે સઅંગત હોય તેટલે સુધી સુધારેલ અથવા રદ થયેલ સમજવામાં આવશે તથા કાયદા, નિયમ તથા નિયમનને સુસંગત હોય તેટલે સુધી આ કરારની અન્ય જોગવાઈઓ માન્ય રહેશે અને કરાર સહી કરતે વખતે જે રીતે લાગુ પડવાપાત્ર હોય તે રીતે યોગ્ય રીતે અમલી રહેશે.

(૧૮) પ્રોજેક્ટ ફાળવણીથી મેળવનારથી તરફેણમાં એક રજીસ્ટડ હસ્તાતારણ દસ્તાવેજ, ફાળવણીથી મેળવનારાઓના સંઘ અથવા સક્ષમ સત્તામંડળ જે લાગુ પડતું હોય તેનું મજિયારા વિસ્તારોમાં અવિભાજિત પ્રમાણપત્ર ટાઇટલ સહિત કરી આપવાનું રહેશે અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં પ્લોટ એપાર્ટમેંટ અથવા ઇમારત જે લાગુ પડતું હોય તેનો ફાળવણીથી મેળવનારાઓને તથા મજિયારા વિસ્તારોનો ફાળવણીથી મેળવનારાઓના સંઘ અથવા સક્ષમ સત્તામંડળ જે લાગુ પડતું હોય તેને પત્યક્ષ કબ્જો તેમજ સ્થાનિક કાયદાઓમા દર્શાવ્યા પ્રમાણેના મંજૂર થયેલા પ્લાન મુજબના તેને લગતા અન્ય ટાઇટલ ના દસ્તાવેજો નિયત કરેલ સમયમાં સુપ્રત કરવાના રહેશે

એ શરતે કે કોઈ સ્થાનિક કાયદાની અનુપસ્થિતિમાં આ કલમ હેઠળ ફાળવણીથી મેળવનાર અથવા ફાળવણીથી મેળવનારાઓના સંઘ અથવા સક્ષમ સત્તામંડળ જે લાગુ પડું હોય તેની તનફેણમાં પયોજક દ્વારા હસ્તાતરણનો દસ્તાવેજ કબજા પ્રમાણપત્ર મળ્યાના ત્રણ મહિનાની અદર કરી આપવાનું રહેશે.

(૧૯) સદરહું પ્રોજેક્ટમાં અમે “હીર પાર્ક” નામથી સર્વિસ સોસાયટી બનાવીશું અને આ સર્વિસ સોસાયટીમાં તમામ પ્લોટ ધારકોએ મેમ્બર બનવાનું રહેશે.

પરિશિષ્ટ-૧ (પ્લોટીંગ)

ગુજરાત રાજ્યના ડિસ્ટ્રીક્ટ: ભાવનગર તાલુકાના મોજે તરસમીયા ગામની સીમના રેવન્યુ સર્વે નં.૯૪/૨ની નગર રચના યોજના નં.૧૨ (તરસમીયા) ના મૂળ ખંડ નં.૧૧, અંતિમ ખંડ નં.૧૧, ટી.પી.સ્કીમ નં.૧૨ તરસમીયા(ફાઈનલ)ની જમીન ઉપર રેફરેન્સ હેતુ માટે કરવામાં આવેલ બિનખેતી કરવામાં આવેલ પ્લોટો ૧ થી ૧૨, ૧૨-એ, ૧૪ થી ૨૩, ૨૪-૨૫, ૨૬, ૨૭-૨૮ અને ૩૩ થી ૪૦ નું કુલ ક્ષેત્રફળ ૪૦૫૩.૦૦ ચો.મી. થાય છે. જે નોંધાયેલ પ્લોટ નં ૧ થી ૧૨, ૧૨-એ, ૧૪ થી ૨૩, ૨૪-૨૫, ૨૬, ૨૭-૨૮ અને ૩૩ થી ૪૦ ની જમીન ઉપર ભાવનગર મહાનગરપાલિકામાં મંજૂર થયેલ પ્લાન મુજબથી પ્રોજેક્ટ “હીર પાર્ક” ના નામથી ઓળખાય છે. પૈકીનો પ્લોટ નંબર. **એરીયા** ચો મી. (જેના કોમન પ્લોટ ના વરાડે આવતી જમીનની બિનખેતી લિઝ તથા આકાર ભરવાની શરતને આધીન કોમન પ્લોટના વરાડની જમીન ----- ચો.મી જેનો વેચાણમા સમાવેશ નથી) તે ખુલી જમીનની મિલકતની **ચતુ:સિમા** નિચે મુજબ છે.

સદર ફ્લેટ/દુકાનનો વણવહેચાયેલો હિસ્સો _____ ચો.મી. છે

ચતુ:સિમા

ઉત્તર -
દક્ષિણે -
પૂર્વ -
પશ્ચિમે -

પરિશિષ્ટ-૨

ઉપરોક્ત પરિશિષ્ટ-૧ માં વર્ણવેલ જમીન કે જે “હીર પાર્ક” ના નામથી ઓળખાય છે. તે પ્લોટ નં.....એરીયા ચો.મી.આ..... છે. તેની ચતુ:સિમા નીચે મુજબ છે.

ઉત્તર :
દક્ષિણે :
પૂર્વ :
પશ્ચિમે :

પરિશિષ્ટ-૩ (સહીયારી સુવિધા)

આ વેચાણ દસ્તાવેજ અમોએ અમારી રાજી ખુશીથી જીવ કાયમ રાખી વાંચી, વંચાવી, સમજી, વિચારીને સાવધ અવસ્થામાં કોઈપણ જાતના દબાણ વગર અવેજની ચુકતે રકમ, તમારા પાસેથી વસુલ લઈને લખી આપવામાં આવે છે. તે અમોને તથા અમારા વંશ, વાલી, વારસોને કબુલ મંજૂર તથા બંધનકર્તા સહી છે. જેની ખાતરી બદલ આ નીચે અમે અમારી સહી કરી આપી છે.

સ્થળ :

તા.

અત્ર.....મતુ તત્રશાખ

વેચનાર

.....

ખરીદનાર

.....

સાક્ષીઓ :

૧.....

૨.....